

DATE: 19th March, 2022

To BSE Ltd. P. J. Towers Dalal Street, Mumbai - 400 001

> SUB.: Newspaper Advertisement for declaration of Postal ballot Results BSE Scrip Code: 506640

Dear Sir,

Pursuant to Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find attached herewith copies of newspaper advertisement regarding declaration of results of Postal Ballot published on 18th March, 2022 in the Financial Express (Gujarati and English language).

This is for your information and record.

Thanking You,

Yours faithfully,

For, GUICHEM-DISTILLERS INDIA LIMITED

SAGAR SAMIR SHAH DIRECTOR

DIN: 03082957

Web: www.gujchemdistillers.in CIN: L24230GJ1939PLC002480

FINANCIAL EXPRESS

BEFORE THE NATIONAL COMPANY LAW TRIBUNAL BENCH AT AHMEDABAD

COMPANY PETITION IGAA, NO. TO UT 2022 IN COMPANY APPLICATION (CAA.) NO. 64 OF 2021

In the matter of Scheme of Arrangement in the nature of Demerger between Amrapali Industries Limited ('Petitioner Demerged Company' or 'AIL') and Amrapali Asset Reconstruction Company Private Limited ('Petitioner Resulting Company or 'AARCPL') and their respective shareholders

In the matter of Sections 230 read with Section 232 of the Companies Act, 2013 and other applicable provisions of the

Companies Act 2013 Amrapali Industries Limited, (CIN: L91110GJ1988PLC010B74} a Company incorporated under the provisions of Companies Act 1956 having its registered office at Unit No. PD5-020, 5th Floor Tower A WTC Gift City Gandhinagar

Petitioner Demerged Company

Gujarat382355 Amrapa li Asset Reconstruction Company Private Limited (CIN: U65190GJ2010PTC059157) a Company incorporated under the provisions of Companies Act 1956 having its registered office at 19/20/21 3rd Floor, Narayan Chambers, Ashram

Place: Ahmedabad

Date: 17/03/2022

1 Name of the Corporate Debtor

16 Last date for submission of resolution

resolution professional

Authority for approval

resolution professional

the Board

Professional

Place: Ahmedabad

No

18 Estimated date for submission of

resolution plan to the Adjudicating

19 Name and registration number of the

20 Name, Address and e-mail of the

21 Address and email to be used for

correspondence with the Resolution

22 Further Details are available at or with

17 Manner of submitting resolution plans to

plans

2 Date of incorporation of corporate debtor 30/08/2012

Pethoner Resulting Company Road, Ahmedabad Gujarat 380009

마시아 나는 과학 과 경우가 되시면 한 과 경기 때문에

Petition under Sections 230 to 232 of the Companies Act, 2013 was presented by the Petitioner Companies Amragali Industries Limited and Amragali Assets Reconstruction Company Private Limited on 5th January 2022 for sanctioning of the Composite Scheme of Arrangement between Amrapah Industries Limited ("Petitioner Demerged Company's and Amrapali Assets Reconstruction Company Private Limited ('Petitioner Resulting Company') and their respective Shareholders and Creditors and the Pebbon was admitted by the Hon'ble National Company Law Tribunal, Ahmedabad on 7th February 2022. The said Pebbon is fixed for hearing before the Ahmedabad Bench of National Company Law Tribunal (NCLT) on 8° April 2022at 10:30a.m.in the morning or soon the reafter.

ANY PERSON dearous of supporting or opposing the said Petition should send to the Petitioner's Advocate at their address mentioned hereunder, a notice of his intention, signed by him or his Advocate, with his full name and address, so as to reach the Petitioner's Advocate not later than two days before the date fixed for the hearing of the Petition. Where he seeks to oppose the Petition, the grounds of opposition or a copy of the affidavit intended to be used in opposition to the Petition, should be filed in Hon'ble National Company Law Tribunal, Ahmedabad bench at Corporate Bhavan, Istand 2nd Floor, Near Zydus Hospital, Thattej, Ahmedabad, Gujarat – 380059 and a copy thereof served on the Petitioner's Advocate, not less than two days before the date fixed for hearing.

A copy of the Petition will be furnished by the Petitioner's Advocate to any person. requiring the same on payment of the prescribed charges.

> Mr. Yuvraj GThakore Advocate for the Petitioner Companies B/7 Santa Darshan Rats, Near Mercury Petrol Pump, Ashram Road, Ahmedabad - 380009, Gujarat

FORM G INVITATION FOR EXPRESSION OF INTEREST (Under Regulation 36A (1) of the Insolvency and Bankruptcy

B & C Energy Infra Limited

(Insolvency Resolution Process for Corporate Persons) Regulations, 2016)

RELEVANT PARTICULARS

- 64	Date of incorporation of corporate depro-	DO NO POPULATION OF THE POPULA	
3	Authority under which corporate debtor is incorporated / registered	ROC - Ahmedabad	
4	Corporate identity number / limited liability identification number of corporate debtor	U31900GJ2012PLC071773	
5	Address of the registered office and principal office (if any) of corporate debtor	405, Chandraprabhu Corporate House, B/H- Sales India Showroom, Modhera Char Rasta, Mehsana 384002	
6	Insolvency commencement date of the corporate debtor	03/01/2022	
7	Date of invitation of expression of interest	18/03/2022	
8	Eligibility for resolution applicants under section 25(2)(h) of the Code is available at:	All applicants who are not disqualified under section 29A of IBC are eligible subject to further qualification of parameters set by Committee of Creditors, which can be get from the Resolution Professional through email at cirp.baridc@gmail.com	
9	Norms of ineligibility applicable under section 29A are available at:	Refer detailed invitation of Expression of Interest to be provided on request at cirp bandc@gmail.com	
10	Last date for receipt of expression of interest	02/04/2022	
11	Date of issue of provisional list of prospective resolution applicants	12/04/2022	
12	Last date for submission of objections to provisional list	18/04/2022	
13	Date of issue of final list of prospective resolution applicants	27/04/2022	
	Date of issue of information memorandum, evaluation matrix and request for resolution plans to prospective resolution applicants		
15	Manner of obtaining request for resolution plan, evaluation matrix, information memorandum and further information	Eligible Resolution Applicant may submit the request to the RP by email at cirp.bandc@gmail.com	

17/05/2022

16/06/2022

Shah Sanjay Jitendralal

Shah Sanjay Jitendralal

Ahmedabad -380009.

Ahmedabad -380009.

Shah Sanjay Jitendralal

IBBI/IP-P01915/2020-21/13096

Email: sshahfca.ss@gmail.com

Email: cirp.bandc@gmail.com

Bank, Mithakhali Six Road, Navrangpura,

Prospective Resolution Applicant may contact the

Mercantile Bank, Mithakhali Six Road, Navrangpura,

Address: 501,502, Abhijeet-1, Opp Bhuj Mercantile

RP by email at cirp.bandc@gmail.com

Email: cirp.bandc@gmail.com 23 Date of publication of Form G For B & C Energy Infra Limited (in CIRP Shah Sanjay Jitendrala Reg No. IBBI/IP-P01915/2020-21/13096 501,502, Abhijeet-1, Opp Bhuj Mercantile Bank Date: 18/03/2022 Mithakhali Six Road, Navrangpura, Ahmedabad -380009.

resolution professional, as registered with Reg. Address: 501,502, Abhijeet-1, Opp Bhuj

#LAS

MAS FINANCIAL SERVISES LIMITED Narayan Chambers, 2th Floor, B/h. Patang Hotel, Ashram Road, Ahmedabad-380009. Contact: 079-41106500/733

POSSESSION NOTICE (FOR IMMOVABLE PROPERTY) Rule 8(1) of Security Interest (Enforcement Rules 2002)

Whereas the undersigned being the authorized officer of the MAS Financial Services Ltd. under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act - 2002 (54 of 2002) and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 20-11-2021 as on below details calling upon the Borrower/Co-

borrower/Guarantor to repay the amount mentioned in the notice being within Sixty Days from the date of receipt of the said notice. The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower/Co-borrower/Guarantor and the public in general that the

undersigned has taken Symbolic Possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of the said [Act] read with Rule 8 of the Security Interest (Enforcement) Rules 2002, on this 12th Day of March of the year 2022. The Borrower/Co-borrower/Guarantor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with

the Property will be subject to the charge of the MAS Financial Services Ltd. as on below details and interest thereon. The Borrower/Co-borrower/Guarantor attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets

Borrower & Co-Borrower, Guarantor Name	Description Of The Immovable Property	Loan A/C No. Outstanding Amount	Date of Demand Notice Date of Sticking Notce	
Jahidbhai Mohmmadbhai Parmar (Borrower) Najmaben Jahidbhai Parmar (Guarantor)	All those pieces and parcels of free hold Non Agriculture land admeasuring 35.56 sq. mtrs. with construction made or to be made therein bearing Limbdi city Survey No. 429, Limbdi City Survey ward	Loan A/C No. 144815	20-11-2021	
(Guarantor)	1 paiki lying and being at limbdi, within Municipal limits Taluka Limbdi, District Surendranagar, Gujarat and bounded as follows:	Rs. 20,75,908/-	12-03-2022	

Authorized Signatory, Date : 18-03-2022 For, MAS Financial Services Ltd. Mr. Jagdish P. Prajapati (M.) 7624003411 Place : Limbdi, Surendranagar

GUJCHEM DISTILLERS INDIA LIMITED CIN: L24230GJ1939PLC002480

Regd. Office: Office No.6, 2nd Floor, National Chambers, Near City Gold, Ashram Road, Ahmedabad-380009, Gujarat Phone No.: +91-9998933378 | Email: gujchemdistillers@gmail.com | Website: www.gujchemdistillers.in

RESULTS OF POSTAL BALLOT Pursuant to Section 110 of the Companies Act, 2013 read with Rule 22 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The Company had provided the facility of Remote E-voting facility to the members to enable them

to cast their votes electronically on the Resolutions proposed in the postal Ballot notice dated 25.01,2022. The Board of Directors had appointed Mr. Devesh Khandelwal (FCS: 6897) Proprietor of M/s. Khandelwal Devesh & Associates,, Practicing Company Secretary as the Scrutinizer for Conducting Postal Ballot. The Scrutinizer has carried out the scrutiny of all Electronic votes received up to the last date of e-voting i.e 16th March, 2022 till 5.00 p.m. and submitted his report on 17.03.2022 to the chairman.

Based on the scrutinizer Report dated 17.03.2022, the Chairman has declared the results of postal ballot as under:

	Remote e-voting						
Particular of Resolution	No. of Votes Polled	No. of Votes in Favour	No. of Votes Against	% of Votes in Favour	% of Votes in Against		
To Consider and Approve alteration of Main Object Clause of Memorandum of Association of the Company.	91,939	91,939	0	100%	0		
To Consider and Approve new sets of Memorandum of Association (MOA) of the Company as per Companies Act, 2013		91,939	0	100%	0		
To Consider and Approve new sets of Articles of Association (AOA) of the Company as per Companies Act, 2013		91,939	0	100%	0		
To Consider and Approve Sub-Division of face value of the equity shares of the Company		91,939	0	100%	0		
To Consider and approve alteration of Capital Clause of the Memorandum of Association of the Company		91,939	0	100%	0		

Based on the report of the Scrutinizer, resolution as set out in the Postal ballot notice dated 25.01.2022 have been duly approved by the Members with requisite majority. The Postal ballot Results has been hosted on the website of the Company at www.quichemdistillers.in and also communicated to BSE Limited.

RAJASVEE SAGAR SHAH (MANAGING DIRECTOR) Date: 17/03/2022 DIN: 08265565 Place: Ahmedabad

सेन्ट्रल अंड ओइ छन्डिया सेन्ट्रल बैंक ऑफ इंडिया Central Bank of India Email binsural 947@centalbank.co.in

Times Square, Near Vakiikvadi, Opp. Land mark

DEMAND NOTICE 6, Times Square, Near Vaccinnaco, Spin Empire, Magob, Dumbhal, Disk-Surat, Gujarat-3950 to Under Subsection (2) of Section (3) of the SAINES Act 2012

Notice Under Section 13(2) of the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002. A notice is hereby given that following Borrower have defaulted in the repayment of principal and interest of the loan facility obtained i.e. Housing Loan in the name by them from the bank and loan has been classified as a Non Performing Assets INPAI, The Notice was issued to the munder section 13(2) of the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act-2002 on their last known addresss, but it has been returned with remark "Left" and as such

Plot No. 237, South: Plot No. 239

Lha	y are here by informed by way of this public not
Г	Name of Borrower/Co-Borrower /Guarantor and Address

Late Ashokbhai Vaqhjibhai Pansuriya [Borrower, since Deceased] Through it's Legal

Mrs. Dayaben Ashokbhai Pansuriya (Co borrower) A. Mrs. Dayaben Ashok bhai Pansuriya (Wife)

B. Harshil Ashokbhai Pansuriya | Minor Son through its mother & nutural guardian- Mrs Dayaben Ashok bhai Pansuriya) 1) Plot no. 238, Shubh Nandini Residency

Vibhag-1, Kamrej, Surat-394180 2) Plot no B/ 68,, Surya nagar Society, Nr. Dharam Nagar, Sura 1395008, Gujarat, C. Mrs. Urvisha Brijeshbhai Panchan

(Daughter)

Add: 28 Shubhnandini Society Vibhag-2, Dangara Road, Derod, Surat, Gujarat-394180. Type of Account

3994568345 16,00,000.00

Rate of Demand Notice Total Due Amt. Loan **NPA Date** Interest Date Amount as on 14.02.2022

15.02.2022

Description of Mortgaged Property

All the piece and parcel of immovable property, bearing Plot no. 238, adm.

42,38 sq.mtrs, together with undivided proporationate shale adm, 29,15

squintris, total adm. 71.53 squintris, in road and COP in "Shubh Nandini

Readency Vibhag-1", atuated on the land bearing Revenue Block no.

129°C, 130, 131 [Alter consolidation New Block no. 129°C] of Village-

Kamrej, Tal- Kamrej, Dist.-Surat. Owned by Mr. Ashotbhai Vaghjibhai

Pansunya Bounded by - East: Plot no. 281, West: Society Road, North:

The steps are being taken for substitued service of notice. The above borrowers are hereby called upon to make payment of outstanding amount within 60 days from the date of publication of this notice, failting which further steps will be taken after expiry of BOdays from the date of this notice under sub-section [4] of section 13 of securitization and Re-construction of Financial Assets and Enforcement of Security Interest Act-2002.

29.01.2022

7.10%

Authorised Officer, Date: 15.02.2022 Central Bank of India Place: Surat

CORRIGENDUM

HDB FINANCIAL SERVICES LIMITED Registered Office:- Radhika, 2nd Floor,

Law Garden Road, Navrangpura, Ahmedabad- 380009 Regional/ Branch Office: 603, 6th Floor, 21st Century Building, B/s World Trade Centre, Ring Road, Surat- 395007.

Refer to The Advertisement of The Sale Notice Published on 11-03-2022 Under The Borrower's Name M/S Shree Krishna Motors, Loan No. 875033 In The Financial Express (Eng. & Guj) Newspaper in Gujarat Edition. Due to Inadvertent Mistake In The Auction Date Mentioned As 10-04-2022 This is to Be Read As 26-03-2022. All Other Contents Remain Unchanged. Date: 18-03-2022 Place: Surat

Authorised Officer FOR HDB Financial Services Limited

MODULEX CONSTRUCTION TECHNOLOGIES LIMITED

CIN: L45100PN1973PLC182679 Regd Office: A 82, MIDC Industrial Estate, Indapur, Pune - 413 132 Tel: +91 02111 217074 Email id: compliance@modulex.in

Website: www.modulex.in INFORMATION REGARDING THE EXTRA-ORDINARY GENERAL

MEETING TO BE HELD THROUGH VIDEO CONFERENCE (VC) /

OTHER AUDIO VIDEO VISUAL MEANS (OAVM)

1. Shareholders may please note that the Extra-ordinary General Meeting (EGM) of the Company will be held through VC / OAVM on Wednesday, 13th April, 2022 at 1.30 P.M. IST, in compliance with all the applicable provisions of the Companies Act, 2013 and the Rules made there under and the Securities and Exchange Board of India (SEBI) (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, read with General Circular No. 14/2020 dated 8th April, 2020, General Circular No. 17/2020 dated 13" April, 2020, General Circular No. 20/2020 dated 5th May, 2020 and General Circular No. 02/2021 dated 13th January, 2021, and other applicable circulars as may be issued by the Ministry of Corporate Affairs (MCA), Government of India and SEBI in this regard, to transact the business that will be set forth in the

notice of the meeting. 2. In compliance with the above mentioned circulars copy of the notice of the EGM will be sent to all the Shareholders whose email addresses are registered with the Company / Depository Participant(s). The notice of the EGM will also be available on the Company's website at www.modulex.in and on the website of the Bombay Stock Exchange at www.bseindia.com

Manner of registering/updating email addresses:

- Shareholders holding shares in physical mode and who have not updated their email addresses with the Company are requested to update their email addresses by writing to the Company at company.secretary@modulex.in along with the copy of the signed request letter mentioning the name and address of the Shareholder, self-attested copy of the PAN card, and self-attested copy of any address proof of the Shareholder (eg: Driving License, Election Identity Card, Passport) in support of the address of the Shareholder.
- Shareholders holding shares in dematerialized mode are requested to register. update their email addresses with the relevant Depository Participants.

Manner of casting vote through e-voting:

- · Shareholders will have an opportunity to cast their votes remotely on the business as set forth in the notice of the EGM through remote e-voting system.
- . The login credentials for casting the votes through e-voting shall be made available to the Shareholders through email after successfully registering their email addresses in the manner provided above.
- The detailed procedure for casting the votes through e-voting shall be provided in the notice of the EGM. The details will also be made available on the website of the
- This notice is being issued for the information and benefit of all the Shareholders of

the Company in compliance with the above mentioned circulars. For Modulex Construction Technologies Limited

Sd/-Place: Mumbai Bhoomi Mewada Date: 18" March, 2022 Company Secretary

RELIGARE FINVEST LIMITED

RELIGARE SME LOANS

Registered Office: First Floor, P-14, 45/90, P-Block, Connaught Place, New Delhi-110001 Corporate Office: Max House, 7th Floor, Block A, Dr. Jha Marg, Okhla Phase-III, Okhla Industrial Estate, New Delhi 110020 Branch Office: 1006/7, Shivalik Shilp, Iscon Cross Road, S. G. Highway, Ahmedabad - 380015, Gujarat

APPENDIX-IV-A

AUCTION-CUM-SALE NOTICE BY PRIVATE TREATY

Auction-cum-Sale Notice (by Private Treaty) for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act (SARFAESI Act), 2002 read with proviso to Rule 8(6) & Rule 9(1) of the Security Interest (Enforcement) Rules, 2002 Notice is hereby given to the public in general and in particular to the Borrower(s)/Guarantor(s)/Mortgager(s) for conducting

the auction-cum-Sale (by way of private treaty) of the below described immovable property (in short 'property') mortgaged/charged to the Secured Creditor (i.e., M/s Religare Finvest Ltd., in short 'RFL') who has received expression of interest/an offer from an intended purchaser to purchase the said property at the amount mentioned below as 'Reserve price' and therefore the undersigned further offers for Sale at more than reserve price on "As is where is", "As is what is", "Whatever there is" and "No recourse" basis till 11:30 AM of 25th Day of April 2022 (Scheduled Auction /Sale Date) for recovery of Rs. 6.24.13.704.07/- (RUPEES SIX CRORES TWENTY FOUR LAKHS THIRTEEN THOUSAND SEVEN HUNDRED FOUR AND SEVEN PAISA ONLY) as on 17th day of October 2020 along with upto date, interest, costs and charges due to the RFL from the Borrower(s) /Guarantor(s) / Mortgagor(s) Namely, M/s MANAN MOTORS PVT. LIMITED, RAJENDRASING SOMSINGH ZALA, MANAN AUTO LINK PRIVATE LIMITED, CHHAYA ANILBHAI PATEL, ANIL KANJIBHAI PATEL, PARUL R ZALA, DAHYABHAI JOITARAM PATEL & PUNITABEN M SHARMA as the said above mentioned Borrower(s) /Guarantor(s) Mortgagor(s) have failed to repay the loan amounts of the Secured Creditors within 60 days from the date of notice dated 20/10/2020 issued by its authorized officer under section 13(2) of the SARFAESI Act 2002.

Whereas the Secured Creditor has taken the possession of the mortgaged property as mentioned below pursuant to the powers vested in it through its authorized officer on 14/01/2021 under the provisions of Section 13(4) of the SARFAESI Act, 2002 read with Rule 8(1) of 'The Security Interest (Enforcement) Rules, 2002' and in exercise of powers conferred there under.

Notice regarding taking of such possession under the provisions of section 13(4) of the SARFAESI Act, 2002 was published in Jai Hind (Gujarati) & Western Times (English) editions newspapers on 20/01/2021 under Rule 8(2) of The Security Interest (Enforcement) Rules 2002. And whereas even thereafter the borrower(s) /Guarantor(s) / Mortgagor(s) failed to repay the aforesaid loan to the RFL, and the

intended purchaser(s) have submitted a letter of intent to the RFL indicating their interest to purchase the said property at the amount mentioned below as Reserve price. Accordingly, the authorized officer of the Secured Creditor has decided to sell the said scheduled property. The reserve price for the auction of said property will be Rs.6,25,00,000/- (Rupees Six Crores Twenty Five Lakhs only) and

the Earnest Money Deposit (EMD) will be Rs.62,50,000/-(Rupees Sixty Two Lakhs Fifty Thousands Only) i.e. 10% of the reserve price which shall be required to be submitted by way of DD/PO in favor of "Religare Finvest Limited" along with with the Bid by the intended bidder(s)/purchaser(s) at RFL's Branch Office "1006 & 1007, Shivalik Shilp, Iscon Cross Roads, S. G. Highway, Ahmedabad 380015" on or before 11:30 AM of 25th Day of April 2022 (Scheduled Auction /Sale Date). The successful bidder/purchaser shall pay a deposit of at least 25% of the Sale Consideration. [inclusive of EMD amt. paid with the Bid] either on the same day of Sale Confirmation or not later than next working day. Balance sale consideration shall be required to be deposited within 15 days from Sale confirmation date.

SHORT DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY All that piece & parcel of the -immovable property having commercial use Land Area of 8293 Sq.Mtr. (89232.68 Sq. Fts.).

bearing "BLOCK NO. 148 A, SITUATED AT MOUJE, KAMOD TALUKA, DASCROI, AHMEDABAD - 382427

Boundaries (as per Site/Actual)- East: -Pirana Suez Road, North: Ring Road, West: Block No. 177 & 154, South:- Block No. 152 & 153, Nature of Secured asset - Freehold.

Known Encumbrances.....Nill The property is being sold with all the existing and future encumbrances whether known or unknown to the Authorized Officer/

Date of Demand Notice Reserve Price EMD

Secured Creditor and Authorized Officer/Secured Creditor shall not be responsible in any way for any third-party claims/rights/dues Interested parties should make their own assessment of the secured asset to their satisfaction. Secured Creditor (RFL) does not in any way guarantee or makes any representation with regard to the fitness/title of the aforesaid secured asset. For detailed terms and conditions of the sale, please refer to the link/URL provided in RFL (Secured Creditor's) website i.e.

https://www.religarefinvest.com/. For any other information, please contact Mr. Chintan Vasani on his Mobile no. 9099932925 or contact him at his e-mail id. chintan.vasani@religare.com

Date: 15.03.2022 **Authorised Officer** Place : Ahmedabad Religare Finvest Limited



Home First Finance Company India Limited,

Rs. 16,63,547.00

CIN: L65990MH2010PLC240703

Loan

Housing Loan

Website: homefirstindia.com, Phone No.: 180030008425, Email ID: loanfirst@homefirstindia.com

APPENDIX- IV-A [See proviso to rule 8 (6)]

SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES

E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002

Notice is hereby given to the public in general and in particular to the Borrower (s) and Co-Borrower (s) as per column (ii) that the below described immovable properties as per column (iii) mortgaged/charged to the Secured Creditor, the physical possession of which has been taken by the Authorised Officer of Home First Finance Company India Limited for realization of its dues plus interest as detailed hereunder and whereas consequent upon failure to repay the dues, the undersigned in exercise of power conferred under Section 13(12) of the said Act proposes to realize dues by sale of the said property/ies and it will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" as described hereunder. The auction will be conducted "On Line", for the recovery of amount due from Borrower (s) and Co-Borrower (s) as per column (i), due to Home First Finance Company India Limited.

ir. Io	and Guarantor(s)	PF	ROPERTY ADDRESS		Demand Notice	O/s Amount (in Rs.)	Possession	Amount (in Rs.)	Amount (in Rs.)	Time of e-Auction	of Submission Of EMD & Documents	Authorised Officer
1	Hetalben Gangani, Dharmendra Gangani, Ghanshyambhai Gangani	Flat No. 202, Maruti residency, R.S. Gujarat 394185	no.361, Block no. 348, Plot no. 21, Moje Nans	sad, Kamrej, Surat	01.04.2021	1,141,327	02.07.2021	1,174,400	117440	04-04-2022 (11am-2pm)	02-04-2022 (Upto 5pm)	8320607269
	E-Auction Se	rvice Provider	E-Auction Website/For Details, Other terms & conditions		or depositing	~	Branch IFSC Co	ode	Name	of Beneficiary3		

E-Auction Service Provider	E-Auction Website/For Details, Other terms & conditions	A/c No: for depositing EMD/other amount	Branch IFSC Code	Name of Beneficiary3
M/s E-Procurement Technologies Ltd -Auction Tiger, Help Line No: 079-35022160 / 149 / 82 Contact Person: Ram Sharma Mo: + 91 80000 23297 -mail id: support@auctiontiger.net & ramprasad@auctiontiger.net,	http://www.homefirstindia.com https://homefirst.auctiontiger.net	912020036268117 - Home First Finance Company India Limited - Axis Bank Ltd., MIDC, Andheri East.	UTIB0000395	Authorized Officer, Home First Finance Company India Limited

Bid Increment Amount - Rs. 10,000/-. The sale will be done by the undersigned through e-auction platform provided at the Web Portal (https://homefirst.auctiontiger.net). E-Auction Tender Document containing online e-auction bid form, declaration, General Terms & Conditions of online auction sale are available at Portal Site. To the best of knowledge and information of the Authorized Officer, there is no encumbrance on the properties. However, the intending bidders should make their own independent inquiries regarding the encumbrances, title of property/ies put on auction and claims/ rights/ dues/ affecting the property, prior to submitting their bid. The e-Auction advertisement does not constitute and will not be deemed to constitute any commitment or any representation of Home First. The Authorised Officer/ Secured Creditor shall not be responsible in any way for any third-party claims/ rights/ dues. The sale shall be subject to rules/conditions prescribed under the securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002,

STATUTORY 15 DAYS SALE NOTICE UNDER THE SARFAESI ACT, 2002

The borrower/ guarantors are hereby notified to pay the sum as mentioned in the demand notice along with upto date interest and ancillary expenses before the date of e-Auction, failing which the property will be auctioned/ sold and balance dues, if any, will be recovered with interest and cost Signed by Authorized Officer, Home First Finance Company India Limited Date: 18/03/2022, Place: Surat

financialexp.epapr.in

Date and



Ahmedabad

Last Date & Time Number of

ફોર્મ જી એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ માટે આમંત્રણ (ઇન્સોલ્વેન્સી અને બેન્કપ્ટસી (કોર્પોરેટ પર્સન્સ માટે ઇન્ રીઝોલ્યુશન પ્રક્રિયા) નિયમનો, ૨૦૧૬) ના નિયમન ૩૬ એ (૧) હેઠળ સબંદાત વિગતો કોર્પોરેટ દેવાદારનું નામ બી એન્ડ સી એનર્જી ઇન્ફા લીમીટેડ . કોર્પોરેટ દેવાદારના સંસ બોથોરીટી જેના હેઠળ કોર્પોરેટ ડેબ્ટર ઇનકોર્પોરેટડ/રજીસ્ટર્ડ છે કોર્પોરેટ દેવાદારનો કોર્પોરેટ ઓળ U31900GJ2012PLC071773 નંબ૨ / લીમીટેડ લાયબીલીટી આઇડેન્ટીફીકેશન નંબર કોર્પોરેટ દેવાદારની રજસ્ટર્ડ ઓકીસ અને ૪૦૫, ચંદ્રપુભુ કોર્પોરેટ હાઉસ, સેલ્સ ઇન્ડિયા શો રૂમ પાછળ, મોઢેરા ચાર મુખ્ય ઓફીસ (જો હોય તો) નું સરનામું રતા, મોઢેરા ચાર રસ્તા, મહેસાણા ૩૮૪૦૦૨ કોર્પોરેટ દેવાદારની ઇન્સો શરૂ થવાની તારીખ મેક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટન આમંત્રણની તારીખ કોડની કલમ ૨૫(૨)(એચ)હેઠળ ોસીની કલમ ૨૯ એ હેઠળ ગેરલાયક ન હોય તેવા તમામ અરજદારો રીઝોલ્યુશન અરજદારોની લાયકાત કમીટી ઓક ક્રેડીટર્સ દ્વારા નિયત કરાયેલ લાયકાતના માપદંડો, જે રીઝોલ્યશન ઉપલબ્ધ રહેશેઃ પ્રોફેશનલ પાસેથી cirp.bandc@gmail.com ઉપર ઇમેઇલ કરીને મંગાવી . કલમ ૨૯એ હેઠળ લાગુ લાયકાતના વિગતવાર એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટનું આમંત્રણ જોવું જે અરજી કરવા પર નિયમો ઉપલબ્ધ રહેશેઃ cirp.bandc@gmail.com દ્વારા પુરા પાડવામાં આવશે. . એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટર્ન ०२.०४.२०२२ સુપરતગીની છેક્ષી તારીખ ૧. ભાવી રીઝોલ્યુશન અરજદારોની કામચલાઉ યાદી જારી કરવાની તારીખ 12.08.2022 કામચલાઉ યાદીના વાંધાઓ સુપરત १८.०४.२०२२ કરવાની છેક્ષી તારીખ ભાવી રીઝોલ્યુશન અરજદારોની અંતિમ २७.०४.२०२२ યાદી જારી કરવાની તારીખ ાહીતી મેમોરેન્ડમ, મુલ્યાંકન મેટ્રીક્ર અને ભાવી રીઝોલ્યુશન અરજદારોને રીઝોલ્યુશન પ્લાનની વિનંતી જારી કરવાની તારીખ ૫. રીઝોલ્યુશન પ્લાન, મુલ્યાંકન મેટ્રીક્સ, લાયક રીઝોલ્યુશન અરજદારો તેમની અરજી આરપીને યાહીતી મેમોરેન્ડમ અને અન્ય માહિતી irp.bandc@gmail.com ઉપર ઇમેઇલ કરીને જમા કરી શકે છે. માટે વિનંતી મેળવવાની રીત ૬.∣ રીઝોલ્યુશન પ્લાનની સુપરતગીની છેલ્લી તારીખ ભાવી રીઝોલ્યુશન અરજદારો આરપીનો cirp.bandc@gmail.com ઉપર રીઝોલ્યુશન પ્રોફેશનલને રીઝોલ્યુશન ઇલ કરીને સંપર્ક કરી શકે છે. પ્લાનો સુપરત કરવાની રીત ૮. એડજડીકેટીંગ ઓથોરીટીને મંજરી માટે १६.०६.२०२०२ રીઝોલ્યુશન પ્લાનની સુપરતગીની અંદાજિત તારીખ . રીઝોલ્યશન પ્રોકેશનલનંનામ શાહ સંજય જીતેન્દ્રલાલ અને રજીસ્ટ્રેશન નંબર રજી. નં. : IBBI/IP-P01915/2020-21/13096 ૦. રીઝોલ્યુશન પ્રોફેશનલનું નામ, સરનામું રજી.સરનામુંઃ ૫૦૧, ૫૦૨, અભિજીત-૧, ભુજ મર્કેન્ટાઇલ બેંક. અને ઇમેઇલ, બોર્ડના ૨જીસ્ટર્ડ મુજબ મેઠાખળી છ રસ્તા, નવરંગપુરા, અમદાવાદ- ૩૮૦૦૦૯ ઇમેઇલ : sshahfca.ss@gmail.com રજી.સરનામું: ૫૦૧, ૫૦૨, અભિજીત-૧, ભુજ મર્કેન્ટાઇલ બેંક, મિઠાખળી છ ૧. રીઝોલ્યુશન પ્રોફેશનલ સાથે પત્રવ્યવહાર નું સરનામું અને ઇમેઇલ સ્તા, નવરંગપરા, અમદાવાદ- ૩૮૦૦૦૯ ઇમેઇલ : sshahfca.ss@gmail.com . વધુ વિગતો મેળવી શકાશે શાહ સંજય જીતેન્દ્ર લાલ ઇમેઇલ : cirp.bandc@g १८.०३.२०२२ ર ૩. ફોર્મ જી ના પ્રકાશનની તારીખ બી એન્ડ સી એનર્જી ઇન્ફા લીમીટેડ (ફડચામાં) વર્ત શાહ સંજય જીતેન્દ્રલા ਵਲੂ. ਕਾਂ. IBBI/IP-P01915/2020-21/1309 ૫૦૧, ૫૦૨, અભિજીત–૧, ભુજ મર્કેન્ટાઇલ બેંક, મિઠાખળી દ તારીખ : ૧૮.૦૩.૨૦૨૨

ટાટા કેપિટલ હાઉસિંગ ફાયનાન્સ લીમીટેડ સ્ઝાસ્ટર્ડ ઓફીસ : ૧૧મો માળ, ટાવર એ, પેનિનસુલા બિઝનેસ પાર્ક, ગણપતરાવ કદમ માર્ગ, લોઅર પરેલ, મુંબઇ - ૪૦૦૦૧૩ CIN No. U67190MH2008PLC187552

રસ્તા, નવરંગપુરા, અમદાવાદ- ૩૮૦૦૦૯

માંગણા નોટીસ

થળ : અમદાવાદ

સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ (એન્ટ્રોરેમેન્ટ) વિચમો, ૨૦૦૨ (નિચમો) ના નિચમ 3 સાથે વેચાતા સિક્ચોરીટાઇગ્રેશન અને રીકન્સ્ટ્રફ્લાન્ ઓફ ફાંચનાન્સિયલ એસેટ્સ અને એન્ટ્રોરેમેન્ટ ઓફ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨, (એક્ટ) ની કલમ ૧૩(૨) હેઠળ જણાવાનું કે ટાટા કેપિટલ હાઉસિંગ ફાચનાન્સ લીમીટેડ (ટીસીએચએફએલ) ના નીચે સહી કરનાત અદિકારીએ સિક્ચોરીટીટાઇગ્રેશન અને રીકન્સ્ટ્રફ્શન ઓફ ફાચનાન્સ્ત્રિયલ એસેટ્સ અને એન્ટ્રોર્સમેન્ટ ઓફ સિક્ચોરીટીટાઇગ્રેશન અને રીકન્સ્ટર્ટફ્શન ઓફ ફાચનાન્સ્ત્રિયલ એસેટ્સ અને એન્ટ્રફ્સમેન્ટ ઓફ સિક્ચોરીટીટાઇગ્રેશન અને ટ્રેન્ટ એક્ટર, ૨૦૦૨ અને સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એક્ટરીને અન્ટ (ન્યાને અને પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરીને એક્ટની કલમ ૧૩(૨) હેઠળ નીચે જશાવેલ વિટાતવાર માંગણા નોટીસ જારી કરીને અહીં નીચે જશાવેલ તમામને વ્યક્તિગત રીતે અથવા એક સાથે દેવાદારો તરીકે દશાવેલ છે) / કાનુની વારસદાર(૨ો)/કાનુની પ્રતિનિદ્યિઓને સંબંધિત માંગણા નોટીસમાં જશાવેલ સ્ટર્સ સંબંધિત નોટીસની તારીખથી દ્ર દિવસની અંદર ચુકવવા જશાવ્યું હતું. જશાવેલ નોટીસની નક્લો ૨ઝ્ઝરર્ટ પોસ્ટ એ.ડી દ્વાર બજવાયમાં આવી છે અને નીચે સહી કરનાર પાસે ઉપલબ્ધ છે અને જશાવેલ કરજદાર(૨ો)/કાનુની વારસદાર(૨ો)/કાનુની વારસદાર(૨ો)/કાનુની વારસદાર(૨ો)/કાનુની પાસ્ટ એ.ડી દ્વાર કર્યાલ કરિયો કલાકો દરમિયાન કોઇપઇ કામકાલના દિવસે નીચે સહી કરનાર પાસે ઉપલબ્ધ છે અને જશાવેલ કરજદાર(૨ો)/કાનુની વારસદાર(૨ો)/કાનુની પ્રતિનિદ્યાના કાલાઇન્સની અને સ્ટાર્સ કલાકો દરમિયાન કોઇપઇન્સ

ઉપરોક્તના અનુસંધાનમાં, આથી એક વખત ફરી નોટીસ આપવામાં આવે છે કે જણાવેલ દેવાદાર(રો)/કાનુની વારસદાર(રો)/કાનુની પ્રતિનિધિ(ઓ) ટીસીએચએફએલને સંબંધિત નોટીસ(સોની તારીખથી દૃ૦ દિવસની અંદર નીચે તેમના સંબંધિત નામો સામે જણાવેલ રકમ તેમજ લોન એગ્રીમેન્ટ અને જણાવેલ દેવાદાર(રો) દૃારા કરાચેલ દસ્તાવેજો/લખાણો જો કોઇ હોય તોની સાથે વંચાતા ચુકવણી અને/વસુલાતની તારીખ સુધી કોલમ (ડી) માં નીચે જણાવેલ તારીખોથી ચડત વ્યાજ સહીત ચુકવવા જણાવામાં આવે છે. લોનની બાકી ચુકવણી માટે સિક્ચોરીટી તરીકે જણાવેલ દેવાદાર(રો) દૃારા નીચેની સિક્ચોર્ડ એસેટ(ટો) ટીસીએચએફએલને ગીરો કરાચેલ છે.

જણાવેલ દેવ	જ્ણાવેલ દેવાદાર(રો) દ્વારા નીચેની સિક્યોર્ડ એસેટ(ટો) ટીસીએંચએફએલને ગીરો કરાચેલ છે.				
લોન એકા. નંબર	દેવાદાર(રો) કાનુની વારસદાર(રો)/ કાનુની પ્રતિનિધિ(ઓ)ના નામ	નીચેની તારીખ મુજબ બાકી રકમ	માંગણા નોટીસની તારીખ	એનપીએની તારીખ	
9088340 6	ભરતભાઇ ગિરદ્યારી દાસ અને અજચ કુમાર ભરતભાઇ રાવલ અને અતુલ કુમાર ભરતભાઇ રાવલ (સહ દેવાદાર)	૦૯.૦૩.૨૦૨૨ મુજબ રૂા. ૧૩,૮૩,૯૪ <i>૭</i> /–	\$\$0\$.80.90	09.02.20 22	

સિક્ચોર્ડ એસેટ્સની વિગત / સ્થાવર મિલકત / ગીરો મિલકત: – ળ્લોક નંબર એમાં બીજા માળે, ફ્લેટ નંબર એ ૨૦૭, માપન વિસ્તાર ૫૮.૮૮ ચો. મી. સાથે ૨૩.૩૪ ચો.મી., 'સમોર હાઇટ્સ' તરીકે ઓળખાતા પરિસર/કેમ્પસના બિલ્ડીંગની જમીનમાં અવિભાજિત પ્રમાણસરનો હિસ્સો તેમજ તેમાંના દરેક આંતરિક અને બાહ્ય અધિકારો ધરાવે છે, જે રહેણાંક ઉપયોગ માટે બિન ખેતી જમીન ૫૨ બંધાયેલ છે, ખાતા નંબર ૨૯૮, બ્લોક નંબર ૫ અને ખાતા નંબર ૨૮૭, બ્લોક નંબર ૬, ટીપી સ્કીમ નંબર ૭૦ (મુઠીયા) ફાઇનલ પ્લોટ નંબર ૧ અને ૨. મોજે ગામ : મુઠિયા, તાલુકો : અસારવા, જિલો : અમદાવાદ, ગુજરાત ખાતેની મિલકતના દરેક ભાગ અને હિસ્સા. સીમા પૂર્વ : ફ્લેટ નંબર બી ૨૦૧, પશ્ચિમ : ફ્લેટ નંબર એ ૨૦૫, ઉત્તર : ફ્લેટ નંબર એ ૨૦૬, દક્ષિણ : સીડી અને લિફ્ટ

ı	લ્હ૮૫૮૫૨	લાલજીભાઈ ખોડાભાઈ	9505.80.90	999.80.90	०७.०२.२०२२
ı		વાદ્યેલા	સુજબ રા ૧૯ ૯x əxu/–		

સિક્યોર્ડ એસેટ્સની વિગત / સ્થાવર મિલકત / ગીરો મિલકત :- પ્લોટ નંબર બી ૧૨૦ માપન વિસ્તાર પજ ૧૬ ચો.મી સાથે ૪૪.૯૬ ચો.મી. કુલ ૯૯.૧૫ ચો.મી. 'અવધ વિહાર તરીકે ઓળખાતા પરિસર/કેમ્પસના બિલ્ડીંગની જમીનમાં અવિભાજિત પ્રમાણસરને હિસ્સો તેમજ તેમાંના દરેક આંતરિક અને બાહ્ય અધિકારો ધરાવે છે, જે રહેણાંક ઉપયોગ્માટે બિન ખેતી જમીન પર બંધાયોવ છે, જેનો રેવન્થુ સર્વે બ્લોક નંબર ૫૦૦-બી, સર્વે-બ્લોક નંબર ૫૦૯ અને સર્વે – બ્લોક નંબર ૫૧૦, મોજે ગામ મોચલી, જિલ્લો વડોદરા – ૪ ગુજરાત ખાતેની મિલકતના દરેક ભાગ અને હિસ્સા. સીમા પૂર્વ : પ્લોટ નંબર ૧૧૧ પશ્ચિમ : ૯ મીટર રોડ, ઉત્તર : પ્લોટ ૧૧૬, દક્ષિણ : પ્લોટ નંબર ૧૨૧

૧૦૨૦૫૩૨૬ <i>૭</i> અને ૧૦૨૩૮૯૩૧	પ્રકાશકુમાર રેવાજી ઘાંચી	૦૯.૦૩.૨૦૨૨ મુજબ રૂા. ૧૯,૯૪,૨૪૫/–	999.80.90	oø.oə.əoəə
40436634		₹1. ₹6,60,804/-		

સિક્ચોર્ડ એસેટ્સની વિગત / સ્થાવર મિલકત / ગીરો મિલકત: – ફલેટ નંબર એ- ફ, બ્લોક નંબર એ, ભોંચતળીચે, માપન વિસ્તાર ૧૨૮ વાર, 'સોના હી સોના' તરીકે ઓળખાતા પરિસર/કેમ્પસના બિલ્કીંગની જમીનમાં અવિભાજિત પ્રમાણસરનો હિસ્સો તેમજ તેમાંના દરેક આંતરિક અને બાહ્ય અદિકારો ધરાવે છે, જે રહેણાંક ઉપયોગ માટે બિન ખેતી જમીન પર બંધાયેલ છે, જેનો રેવન્થુ સર્વે ૭૮૬ –૨, ટીપી સ્કીમ નંબર ૧૧૪ (વસ્તાલ – રામોલ), ફાઈનલ પ્લોટ નંબર ૪૦, મોજે ગામ વસ્તાલ – રામોલ, તાલુકો – દસક્રોઈ, જિલો – અમદાવાદ, ગુજરાત ખાતેની મિલકતના દરેક ભાગ અને હિસ્સા, સીમા પૂર્વમાં : ફલેટ નંબર એ –૫, પશ્ચિમ : ખુલો પ્લોટ, ઉત્તરમાં : જગ્યા છોડીને ફલેટ નંબર એ – ૭, દક્ષિણમાં – જગ્યા છોડીને બ્લોક બી

१०१६८६२१	રવિન્દ્રકુમાર હસમુખભાઈ	99.03.2022	99.03.2022	00.02.2029
	પટેલ, શ્રીમતી રાધિકાબેન	મુજબ		
	ວຸເປັນຂອກເວັນເອີດ	રૂા. ૧૭,૭૧,૯૬૭/-		

સિક્યોર્ડ એસેટ્સની વિગત / સ્થાવર મિલકત / ગીરો મિલકત :- બિલ્ડિંગ ડી અને ઈમાં દુકાન નંબર ૧૧, માપન વિસ્તાર ૨૦.૫૦ ચો.મી સાથે ૧૪ ચો.મી જમીન. 'આશ્રય ગોલ્ડ['] તરીકે ઓળખાતા પરિસર/કેમ્પસના બિલ્ડીંગની જમીનમાં અવિભાજિત પ્રમાણસરનો હિસ્સો તેમજ તેમાંના દરેક આંતરિક અને બાહ્ય અધિકારો ધરાવે છે. વે રહેણાંક ઉપચોગ માટે બિન ખેતી જમીન પર બંધાચેલ છે, સર્વે નંબર ૨૦૪–૧, માપન ૦–૩૭–૮૩ ચો.મી. ટીપી સ્કીમ નંબર ૬૬ – (૨ાણી૫ – ચેનપુર – ચાંદલોડિયા) ફાઈનલ પ્લોટ નંબર ૯૨ માપન ૫૦૦૨ ચો.મી. મોજે ગામ : રાણીપ, તાલુકો : અમદાવાદ –૨ વાડજ અમદાવાદ, ગુજરાત ખાતેની મિલકતના દરેક ભાગ અને હિસ્સા. સીમા પૂર્વ : ફ્લેટ પાર્કિંગ, પશ્ચિમ : ટીપી રોડ, ઉત્તર : દુકાન નંબર ૧૨, દક્ષિણ : દુકાન નંબર ૧૦ ૈઉપર જણાવેલ તારીખોએ સંબંધિત માંગણા નોટીસોમાં વધુ વિગતવાર જણાવેલ દરે ચડત વ્યાજ એડીશનલ વ્યાજ તેમજ ચુકવણી અને/અથવા વસુલાતની તારીખ સુધી લદાચેલ આકસ્મિક ખર્ચ કોસ્ટ, ચાર્જ વગેરે સહીત. જો જ્યાવેલ દેવાદાર(રો) ઉપર જ્યાવ્યાં મુજબ ટીસીએચએફએલને ચકવણી કરવામાં નિષ્કળ જશે તો ટીસીએચએકએલ જણાવેલ એક્ટની કલમ ૧૩ (૪) અને લાગ નિયમો હેઠળ ઉપર જણાવેલ સિક્યોર્ડ એસેટ(ટો) સ્થાવર મિલકત (તો) સામે કાર્યવાહી કરશે અને તે સંપુર્ણપણે જ્ણાવેલ દેવાદાર(રો)/કાનુની વારસદાર(રો)/કાનુની પ્રતિનિધિ(ઓ) ના જોખમે ૨હેશે. જ્યાવેલ દેવાદા૨(૨ો)/કાનુની વા૨સદા૨(૨ો)/કાનુની પ્રતિનિધિ(ઓ)ને જ્યાવેલ એક્ટ હેઠળ ટીસીએચએફએલની આગોતરી મંજુરી વગર ઉપર જ્ણાવેલ સિક્ચોર્ડ એસેટ(ટો)/સ્થાવર મિલકત(તો) ની વેચાણ, ભાડે અને અન્ય રીતે તબદીલીની મનાઇ ફરમાવામાં આવે છે. કોઇપણ વ્યક્તિ એક્ટ અથવા તે હેઠળ રસાચેલ નિયમોની જોગવાઇઓનો ભંગ કરે છે અથવા ભંગ કરવામ સહાય કરે છે તો તે એક્ટ હેઠળ નિયત કરાયેલ જેલ અને/અથવા દંડને પાત્ર બનશે.

રહીલ કર કે લાલ ઇક્ટ હુંઆ ખેવલ કરાવલ પલ ઇખ/ઇચલા ટંડળ વાત્ર બળતા. રથળ : અમદાવાદ સહી/– અધિકૃત અધિકારી તારીખ : ૧૮.૦૩.૨૦૨૨ ટાટા કેપિટલ હાઉસિંગ ફાયનાન્સ લીમીટેંડ વતી

કબજા નોટીસ

આથી, જના સ્મોલ ફાયનાન્સ બેંક લીમીટેક (અગાઉ જનલકમી ફાયનાન્સિયલ સર્વિસીઝ લીમીટેક તરીકે જાણીતી) ના અધિકૃત અધિકારીએ, સિક્ચોરીટાઇઝેશન અને રીકન્સ્ટ્રફ્શન ઓફ્ ફાયનાન્સિયલ એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ હેઠળ અને સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ હેઠળ અને સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ (એન્કોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૩ સાથે વંસાતી કલમ ૧૩(૧૨) હેઠળ અને મળતી સત્તાનો ઉપયોગ કરીને દેવાદાર(ચે)/ સહ-દેવાદાર(ચે) ને માંગણાં નોટીસ જારી કરી દેવાદારોને તેમના લાગતાવળગતા નામ સામે જણાવેલ ૨૬મ જણાવેલ નોટીસમાં જણાવ્યા મુજબ લાગુ દરોએ તેના પરના વ્યાજ તેમજ ચુકવાળી અને / અથવા છુટકારાની તારીખ સુધી લદાચેલ સડત હોય સ્ટાપ્ત લાગુ હાઇકર સુકવાળ જણાવ્યું હતું.

	3 3-	3		
ક્રમ ન.	લોન નંબર	દેવાદાર/ સહ–દેવાદાર/ જામીનદાર/મોર્ગેજર	૧૩(૨) નોટીસની તારીખ / બાકી રકમ (રૂા. માં) ના રોજ	કબજાનો પ્રકાર અને તારીખ / સમય
9	3005440000544	૧) મેસર્સ લક્કી બેક્સી જેના પ્રતિનિધિ અને પ્રોપરાયટર મહમંદ અઝીમ મહમંદ ઉમર અંસારી, ૨) શ્રી મહમંદ નઝિમ મહમંદ ઉમર અંસારી ૩) મહમંદ નઝિમ અંસારી	૨૭/૧૨/૨૦૨૧ ફ્રા. ૧,૦૦,૦૮૪.૭૮/– (રૂપિચા એક લાખ સૌર્ચાસી અને ઇઠ્યોતેટ પૈસા પુરા) ૦૭/૧૨/૨૦૨૧ મુજબ	૧૫/૦૩/૨૨ ૧૦:૧૫ એએમ અને સાંકેતિક કબજો

સિક્ચોર્ડ એસેટ્સની વિગત : રો હાઉસ નં. એ/3૬, ગુલાબ નગર, સુએઝ ફાર્મ, રમેશ નર્સરી, પીરાણા રોડ, બેગારામપુરા, અમદાવાદ ખાતેની સ્થાવર મિલકતના તમામ ભાગ અને હિસ્સા. **ચતુ:સીમા : ઉત્તર** : ૫૦ ચો. ચાર્ડ રો હાઉસ, **દક્ષિણ** : ૫૦ ચો. ચાર્ડ રો હાઉસ, **પુર્વ** : ૧૫૦ ફુટ, **પશ્ચિમ** : ૫૦ ચો. ચાર્ડ રો હાઉસ

ી જના	સ્મોલ ફાયનાન્સ બેંક	
તારીખ : ૧૭.૦૩.૨૦૨૨	જના સ્મોલ ફાયનાન્સ બેંક લીમીટેડ વતી	
સ્થળ : અમદાવાદ	સહી/– અધિકૃત અધિકારી	
સાથે કોઇપણ સોદો જના સ્મોલ ફાયનાન્સ બેંક લીમીટેડના ચાર્જને આધિન રહેશે.		

(શિક્ચુલ્ક <u>કોમસિંચલ બેંક)</u> <u>રજીસ્ટર્ડ ઓફીસ:</u> દ્ધ ફેરવે, ગ્રાઉન્ડ અને પહેલો માળ, સર્વે નં.૧૦/૧, ૧૧/૨ અને ૧૨/૨બી, ઓફ ડોમલુર, કોરમંગલા ઇનર રીંગ રોડ, ઇજીએલ બિઝનેશ પાર્ક પછી, ચદ્ધાઘદ્ધા, બેંગ્લોર–પદ્૧૦૭૧. <u>રીજનલ બ્રાન્ચ ઓફીસ</u>: જના સ્મોલ ફાયાન્સ બેંક લીમીટેડ, ગ્રાઉન્ડ ફ્લોર, બીજો માળ, સાંગરીલા આર્કેડ, સારસ્વત બેંક ઉપર, ૧૦૦ ફૂટ આનંદ નગર રોડ, શ્યામલ, અમદાવાદ, ગુજરાત–૩૮૦૦૧૫.

🐠 ગુજકેમ ડિસ્ટ્રીલર્સ ઇન્ડિયા લીમીટેડ

(CIN:L24230GJ1939PLC002480) રજીસ્ટર્ડ ઓફીસ: ઓફીસ નં. દૃ, બીજો માળ, નેશનલ ચેમ્બર્સ, સિટી ગોલ્ડ પાસે, આશ્રમ રોડ, અમદાવાદ–૩૮૦ ૦૦૯ ફોન : ૦૭૯–૨૬૫૮૦૮૯૩ વેબસાઇટ: www.gujchemdistillers.com | ઇમેઇલ: gujchemdistillers@gmail.com

પોસ્ટલ બેલોટના પરિણામો

કંપની અદિનિયમ ૨૦૧૩ ની કલમ ૧૧૦ સાથે વંચાતા કંપની (વ્યવસ્થાપન અને પ્રશાસન) નિયમો, ૨૦૧૪ અને સેબી (લિસ્ટીંગ ઓપ્લીગેશન્સ અને કિસક્લોઝર રીક્વાચરમેન્ટ્સ) નિયમનો, ૨૦૧૫ ના નિયમન ૪૪ અંતર્ગત, કંપનીએ પોસ્ટલ બેલોટ નોટીસ્ તારીખ ૨૫.૦૧.૨૦૨૨ માં દર્શાવેલ ઠરાવો પર તેના સભ્યોને ઇલેક્ટ્રોનિક રીતે તેમના મત આપવા સક્ષમ બનાવા માટે રીમોટ ઇ-વોટીંગની સવલત પૂરી પાડી હતી.

ૂળોર્ડ ઓફ્ડ ડાયરેક્ટર્સે પોસ્ટલ બેલોટના સંચાલન માટે રક્કુટીનાઇઝર તરીકે શ્રી દેવેશ ખાંડેલવાલ (એફસીએસ: ૬૮૯૭) મેસસં ખાંડેલવાલ દેવેશએન્ડ એસોસિચેટ્સના પ્રોપરાયટર, વ્યવસાયિક કંપની સેક્રેટરીની નિમણુંક કરી હતી. રક્કુટીનાઇઝરેઇ–વોટીંગની છેલી તારીખ એટલે કે ૧૬ માર્ચ, ૨૦૨૨ ના રોજ સાંજે ૫.૦૦ વાગ્યા સુધી પ્રાપ્ત તમામ ઇલેક્ટ્રોનિક મતોની નોંધ લીધી હતી અને તેને અહેવાલ ૧૭.૦૩.૨૦૨૨ના રોજ ચેરમેનને સોંપ્યો હતો.

સ્ક્રુટીનાઇઝર અહેવાલ તારીખ ૧૭.૦૩.૨૦૨૨ના આધારે, ચેરમેને નીચે મુજબ પોસ્ટલ બેલોટના પરિણામોની ઘોષણા કરી છે.					
રીમોટ ઇ–વોટીંગ					
અપાચેલ મતોની સંખ્યા	મતોની સંખ્યા – તરફેણમાં	મતોની સંખ્યા –વિરૂદ્ધમાં	મતોની ટકાવારી – તરફેણમાં	મતોની ટકાવારી –વિરૂદ્ધમાં	
91,939	91,939	0	100%	0	
91,939	91,939	0	100%	0	
91,939	91,939	0	100%	0	
91,939	91,939	0	100%	0	
91,939	91,939	0	100%	0	
	આપારોલ મતોની સંખ્યા 91,939 91,939 91,939 91,939	સારોલ મતોની મંતોની સંખ્યા સંખ્યા નતરફેશમાં 91,939 91,939 91,939 91,939 91,939 91,939	રીમોટ ઇ-વોર્ટી ગ આપાચેલ મતોની મતોની સંખ્યા નિવસ્તમાં 91,939 91,939 0 91,939 91,939 0 91,939 91,939 0	સમોટ ઇ-વોટોંગ આપાયેલ મતોની મતોની સંખ્યા મતોની સંખ્યા ન્યાં મતોની રકાવાશ - તરફેશમાં -યિરૂબ્લમાં -100% 91,939 91,939 0 100% 91,939 91,939 0 100% 91,939 91,939 0 100%	

સ્ક્રુટીનાઇઝરના અહેવાલના આધારે, પોસ્ટલ બેલોટ નોટીસ તારીખ રપ.૦૧.૨૦૨૨ માં જણાવેલ ઠરાવો આવશ્ચક બહુમતીથી સંભ્યો દ્વારા મંજુર કરાચા છે. પોસ્ટલ બેલોટ પરિણામો કંપનીની વેબસાઇટ www.gujchemdistillers.com પર મુકાચેલ છે અને બીએસઇ લીમીટેડને પણ જાણ કરાચેલ છે. તારીખ: ૧૭.૦૩.૨૦૨૨ (મેનેજિંગ ડાયરેક્ટર)

સ્થળ : અમદાવાદ ડીઆઇએન: ૦૮૨૬ ૫૫૬ ૫

રેલીગેર ફિનવેસ્ટ લીમીટેડ રજીસ્ટર્ડ ઓફીસ : પહેલો માળ, પી–૧૪, ૪૫/૯૦, પી–પ્લોક, કોર્નટ પેલેસ, નવી દિલ્હી–૧૧૦૦૦૧. કોર્પોરેટ ઓફીસ : મેક્સ હાઉસ, સાતમો માળ, પ્લોક એ, ડૉ. ઝાં માર્ગ, ઓખલા ફેઝ-૩, ઓખલા ઇન્ડર્સ્ટ્રીયલ એસ્ટેટ, નવી દિલ્હી–૧૧૦૦૨૦ શાખા ઓફીસ : ૧૦૦૬/૭, શિવાલિક શિસ્પ, ઇસ્કોન ક્રોસ રોડ, એસ.ઝુ. હાઇવે, અમદાવાદ–૩૮૦૦૧૫, ગુજરાત એપેન્ડિક્સ–૪–એ

ખાનગી કરાર દ્વારા હરાજી સાથે વેચાણની નોટીસ

સિક્ચોરિટી એન્ડ રીકન્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્ચોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ (સરફ્રૈસી એક્ટ), ૨૦૦૨ હેઠળ જેમાં સિક્ચોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમ ૨૦૦૨ અંતર્ગત નિયમ ૮(૬) અને નિયમ ૯(૧) ને ધ્યાને લઇને અચલ સંપત્તિના વેચાણ માટે હરાજી સાથે વેચાણની નોટીસ

આ સાથે જાહેર જનતાને અને ૠુણ લેનાર, જામીનદાર અને ૠુણ આપનાર સહિત તમામને ખાનગી કરાર દ્વારા હરાજી સાથે વેચાણની નોટીસ આપવામાં આવે છે. જેમાં સુરક્ષિત દિરાણકાર (મે. રેલિગેર ફિન્ગવેસ્ટ લીમીટેડ એટલે કે આરએ ફએલ) દ્વારા દિરાણ કરાયેલી સંપત્તિ માટે નીચે દર્શાવેલ અનામત કિંમત પરઇચ્છુક ખરીદારો દ્વારા એક્સપ્રેસન ઓફ ઈન્ટરેસ્ટ મળેલ છે. આથી તા. રમમી એપ્રિલ, ર૦૨૨ ના રોજ (હરાજીની તારીખ) સવારે ૧૧ વાગ્યા સુધીમાં "જેમ છે તેમ", "જે છે તે" અને ત્યાં જેટલી વસ્તુ પડેલી છે તેને માટે તા. ૧૭મી ઓક્ટોબર, ૨૦૨૦ ના રોજ બાકી નાણાં રૂા. દૃ,૨૪,૧૩,૭૦૪.૦૭ (રૂપિયા છ કરોડ ચોવીસ લાખ તેર હજાર સાતસો ચાર અને સાત પૈસા) ની વસુલાત કરવા માટે અનામત કિંમતો કરતા ઊંચી કિંમતે વેચાણ માટે હરાજી રાખેલ છે. જેમાં વ્યાજ, ખર્ચ અને ૠુણની રકમ સામેલ છે. ૠુણ લેનાર અને જામીનદાર મેસર્સ મનન મોટર્સ પ્રાઇવેટ લીમીટેડ, રાજેન્દ્રસિંહ સોમસિંહ ઝાલા, મનન ઓટો લિંક પ્રાઇવેટ લીમીટેડ, છાયા અનિલભાઇ પટેલ, અનિલભાઇ કાનજીભાઇ પટેલ, પારૂલ આર ઝાલા, ડાહ્યાભાઇ જોઇતારામ પટેલ અને પુનિતાબેન એમ શર્મા સુરક્ષિત દિધરાણકાર તરફથી દૃ૦ દિવસમાં ૠુણ પરત કરવા માટે તા.૨૦ ઓક્ટોબર, ૨૦૨૦ ના રોજ સરફેસી એક્ટ ૨૦૦૨ ની ધારા ૧૩(૨) હેઠળ અધિકૃત અધિકારી દ્વારા નોટીસ મોકલાઇ હતી, જેમાં તેઓ ૠુણ પરત કરવામાં નિષ્ફળ ગયા છે. આથી સરફેસી એક્ટ ૨૦૦૨ ની ધારા ૧૩ (૪) અને સિક્ચોરિટી ઈન્ટરેસ્ટ (એન્ફોસેન્ટ) નિયમ ૨૦૦૨ ના નિયમ ૮(૧) હેઠળ

સુરક્ષિત ધિરાણકારે આ સંપત્તિ પર તા.૧૪ જાન્યુઆરી, ૨૦૨ ૧ના રોજ કબજો મેળવી લીધો હતો

સંરફેસી એક્ટ ૨૦૦૨ ની ધારા ૧૩(૪) હેઠળ આ સંપત્તિનો પબજો મેળવવા અંગેની નોટીસ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમ ૨૦૦૨ ના નિયમ ૮(૨) હેઠળ જય હિન્દ (ગુજરાતી) અને વેસ્ટર્ન ટાઇમ્સ (અંગ્રેજી) માં તા. ૨૦ જાન્યુઆરી, ૨૦૨૧ ના રોજ છાપવામાં આવી હતી.

ત્યારબાદ પણ ૠુણ લેનાર અને જામીનદાર જે તે ૠુણ આરએફએલને પરત કરવામાં નિષ્ફળ ગયા હતા અને ઈચ્છુક ખરીદારોએ ઉપરોક્ત જણાવેલ અનામત કિંમતે આ મિલકત ખરીદવા માટ આરએફએલ સમક્ષ ઈચ્છા દર્શાવતા પત્રો લખ્યા હતા. જેના કારણે સુરધિત ધિરાણકારે આ સંપત્તિ વેચાણ કરવાનો નિર્ણય લીધો છે.

ુ આ સંપત્તિના વેચાણ માટે અનામત કિંમત રૂા. દુ,રૂપ,૦૦,૦૦૦ (રૂપિયા છ કરોડ પચ્ચીસ લાખ પુરા) રહેશે. આ માટે અનામત કિંમતના ૧૦ ટકા એટલે કે ગ્ર. દુર,૫૦,૦૦૦ અર્નેસ્ટ મની ડિપોઝિટ તરીકે જમા કરાવવાના રહેશે. આ નાણાં રેલિગેર ફિનવેસ્ટ લીમીટેડના નામના ડીડી અથવા પીઓ કરી આરએફએલની શાખા ઓફિસ : ૧૦૦૬–૭, શિવાલિક શિલ્પ, ઇસ્કોન રોડ, એસ.જી હાઇવે, અમદાવાદ,ગુજરાત, ૩૮૦૦૧૫૫૨ તા.૨૫મી એપ્રિલ ૨૦૨૨ના રોજસવારના ૧૧ વાગ્યા પહેલા ઇચ્છુક ખરીદારની બિડની કિંમત સાથે પહોંચાડવાના રહેશે.

સફળ બિડરે કુલ વેચાણ કિંમતના રપ ટકા રકમ વેચાણની ખાતરી થયાના દિવસે અથવા તેના પછીના દિવસ સુધીમાં જમા કરાવવાના ૨હેશે. બાકીના નાણાં વેચાણની ખાતરી થયાના દિવસના ૧૫ દિવસની અંદર ચુકવવાના રહેશે.

અચલ સંપત્તિનું ટુંકુ વિવરણ

બ્લોક નંબર ૧૪૮ એ, મોજે કમોદ, તાલુકો દસક્રોઇ, અમદાવાદ, ૩૮૨૪૨૭ ખાતે વેપારી ઉપયોગ માટેની ૮૨૯૩ ચો.મી (૮૯૨૩૨.૬૮ યો. કુટ) જમીન

આ જમીનને અડતી સીમાઓ : પૂર્વ – પીરાણા સુએઝ રોડ , ઉત્તર – રિંગ રોડ , પશ્ચિમ – બ્લોક નંબર ૧૭૭ અને ૧૫૪ , દક્ષિણ – બ્લોક નંબર ૧૫૨ અને ૧૫૩ , સુરક્ષિણ સંપત્તિની પ્રકૃતિ – ખુલી **અન્ય જાણ હોય તેવા બોજ …… કોઈ નહીં**.

આ સંપત્તિ અધિકૃત અધિકારી અથવા સુરક્ષિણ ધિરાણકારની જાણમાં અને ન જાણમાં હોય તેવા હાલના કે ભવિષ્યના બોજ સાથે વેચાણ માટે મૂકાઈ છે. જેમાં અધિકૃત અધિકારી અથવા સુરક્ષિત ધિરાણકાર અન્ય ત્રાહિત પક્ષના અધિકાર, દાવા અથવા બાકી લેણ માટે જ્વાબદાર નથી. ખરીદી માટે ઈચ્છુક પક્ષકારો પોતાની રૂતે સંપત્તિનું મૂલ્યાંકન કરી શકે છે. સુરક્ષિત ધિરાણકાર (આરએફએલ) આ સુરક્ષિત સંપત્તિ માટે કોઈ દસ્તાવેજી પુરાવા અથવા કોઈ ખાતરી આપતું નથી.

વેચાણ માટેની વિગતવાર માહિતી માટે સુરક્ષિત ધિરાણકારની વેબસાઈટ https://www.religarefinvest.com ધિરાણકારની ચકાસવી. વધુ માહિતી માટે ચિંતનભાઈ વાસાણીનો સંપર્ક કરી શકો છો. તેમનો મોબાઈલ નંબર ૯૦૯૯૩૨૯૨૫ અને ઈ મેલ એડ્રેસ chintan.vasani@religare.com છે.

તારીખ : ૧૫ માર્ચ, ૨૦૨૨ અધિકૃત અધિકારી સ્થળ : અમદાવાદ રેલિગેર ફિનવેસ્ટ લીમીટેડ



Sintex BAPL Limited

Registered Office: 1st Lane, Shahupuri, Kolhapur 416 001 Corporate Office: World One Centre, Tower 2B, 20th Floor, 841, Senapati Bapat Marg, Lower Parel, Mumbai -400 013. CIN L65191PN1943PLC007308

Total Outstanding (Amount in INR Crore)

218.47

INVITATION FOR ASSIGNMENT/SALE OF DUES

RBL Bank Limited ("The Bank") hereby invites proposal from ARCs / NBFCs /Fls /othe eligible entities ('Bidders") for acquisition of its outstanding debt from the following entity ("Company") through a competitive bidding process on a Swiss Challenge basis. The sale of debt is on "As is where is and as is what is basis" and without any recourse to Bank.

Total	218.47			
The schedule of procedure and timelines for the bid are as under:				
Bid Process	Timelines			
Reserve Price	Rs. 54.14 Crs			
Bidders to submit Expression of Interest	22nd March 2022			
Timeline for Due Diligence	22nd March to 30th March 2022			
Bid Submission Date	30th March 2022			
Declaration of Successful Bidder	30th March 2022			
Receipt of assignment consideration	31st March 2022			

The broad terms of the offer are as follows:

Name of Company

- Interested Bidders should submit an Expression of Interest (EOI) in the format which
 can be obtained from the Bank by writing on the email address provided below, expressing
 their interest in conducting the due diligence for acquiring the debt on or before 22nc
 March 2022. Any EOI received after the date and time mentioned herein will be
 considered invalid and shall automatically be rejected. Lender shall bear no responsibility
 for non-receipt of EOI or any other correspondence sent by post/courier or electronically.
- . The EOI should be e-mailed to akbar.panjwani@rblbank.com an anil.dalmia@rblbank.com within the above timelines.
- 3. Preliminary Information Memorandum (PIM) and other details related to the facility will be opened for access by the Prospective Bidders who express their interest in acquiring the debt, subject to execution of a Non-Disclosure Agreement, in the format prescribed by the Bank which shall be sent to the Prospective Bidders separately. Information will be furnished based on data available with the Bank, subject to applicable laws and shall not be deemed to be a representation by the Bank about quality of assets. The Bidders shall, at their own cost, conduct their own due diligence, investigation, analysis, and independent verification.
- 4. The Bank may, at its sole discretion, add, amend, vary, modify, delete, any of the conditions of bid, and/or sale as may be deemed necessary by the Bank by issuing one or more addenda, corrigendum, etc. as required without giving any reasons. The Bank will endeavour to inform each Bidder about the changes /modifications made at the earliest opportunity, however, Bidders are advised to continuously check the website of the Bank for updates.
- website of the Bank for updates.

 5. Any additional document/ information requested by the Bank must be prompth furnished by the Bidder. However, any discussions or any clarification or information sought by the Bank from the Bidder with respect to the EOI or the bid will not constitute an invitation or commitment by the Bank to enter into any agreement with the Bidde nor shall the Bank be liable to consummate or deal with such Bidder based on such
- discussion, negotiation or information sought.

 6. The terms and conditions of placing a bid shall be communicated to all eligible bidder
- 7. By virtue of submission of the offer, it shall be deemed that the participating Bidders have conducted their own independent due diligence in all aspects covering the liabilities, legal proceedings, encumbrances, and any other dues etc, to their complete satisfaction.
- Conditional and contingent offers shall be liable to be disqualified by the Bank.
 The participating Bidder shall not be entitled to withdraw or cancel its offer once submitted
- The participant globust shall have entired to will told aw or cancer its other order action in the stabilities.
 Bids, quoting a price below Reserve Price will be summarily rejected. The Reserve price fixed is only indicative and factor of efflux of time to be borne in mind by the interested bidders, while quoting the price.
- 11. Evaluation of the offers shall be at the sole discretion of the Bank.
- 12. The offer shall remain valid till 31st March 2022 or as extended by the Bank. The entir process of receipt of assignment consideration, execution of assignment agreemen etc, will have to be completed by 31st March 2022. The timelines may be extended at the sole discretion of the Bank.
- 13. Bank reserves its right to reject any or all the EOI, bids, withdraw the loan assets from sale, defer or cancel the sale, extend the timelines at any stage, without assigning any reason whatsoever. All decisions of the Bank in regard to the sale process shall be final and conclusive. No claim for compensation on account of rejection of bids and / or rescinding / cancellation of sale process shall be entertained.
- 14. The successful bidder shall have to pay the entire purchase consideration in cash in the form of RTGS/NEFT in the account of the Bank at the time of execution of Assignmer Agreement which shall be in the format agreeable to the Bank and within the time period specified in the communication of acceptance/ confirmation given by the Bank.
- The successful Bidder shall be solely and absolutely responsible for completion of a statutory regulatory and other compliance and all cost and expenses towards the proposed assignment/sale.
 In the event of any dispute and or difference on the point of meaning or definition of an
- particular word of term used in this Document or in respect to the interpretation of any clause of this document or this document as a whole, the decision of the Bank, shall be final and binding on all the Bidders.

 17. Disputes, if any, arising between parties in relation to this document or the proposed
- offer shall be settled by way of mutual discussion, failing which, the same shal referred to and decided by courts of competent jurisdiction situated at Ahmedabad and governed in accordance with the laws of India.

 18. Any queries or requests for clarification/additional information concerning this EO
- 18. Any queries or requests for clarification/additional information concerning this EC shall be submitted by way of email to akbar.panjwani@rblbank.com anii.dalmia@rblbank.com

Place : Mumbai Date : 18th March 2022 Sd/- Authorised Office RBL Bank Ltd.

